

July marked another month of steady progress for India's economy, driven by strong momentum in infrastructure, technology, and capital markets. Diversified capital expenditure, rising AI investments, and an active IPO market reinforced India's long-term growth potential, creating opportunities for businesses and investors while strengthening confidence in the investment ecosystem.

moneycontrol

FEATURED IN:

MONEY CONTROL

Steptrade Capital secured **₹100 crore** in the first close of **Chanakya Opportunities Fund II**, marking a key milestone. The fund will invest in high-potential pre-IPO businesses across future-focused sectors, reinforcing the firm's commitment to creating long-term investor value.

Outlook MONEY

Kresha Gupta, Director & Fund Manager, highlighted in an article by Outlook Money that lock-in periods in **Alternative Investment Funds (AIFs)** are often misunderstood and should be seen as a strategic feature.

They enable fund managers to execute long-term investment strategies, supporting sustainable value creation and aligning investor expectations with long-term wealth creation.



FEATURED IN:

KhabarPatri
News which Matters to you !!

Ankush Jain, CFA, Director & Fund Manager, highlighted that **Gujarat's Wire-Free City Mission** will modernize urban power infrastructure through underground electricity networks.

Backed by significant government investment, the initiative is expected to improve grid reliability, enhance urban safety, and create long-term opportunities in power transmission, electrical infrastructure, and engineering services, supporting India's infrastructure-led growth.



bt Business Today

Akshay Dawra, Fund Manager, **Chanakya Opportunities Fund II**, shared his views in a Business Today feature on India's robust IPO pipeline and the evolving SME market.

He highlighted that while strong primary market activity presents attractive opportunities, investors should focus on business quality, governance, earnings visibility, and valuations rather than participating in every IPO, emphasizing disciplined stock selection for long-term wealth creation.



KEY UPDATES:



BATTERY ENERGY STORAGE

India's battery energy storage requirement is forecast to grow from **1 GWh to 888 GWh** over the next decade.

The opportunity extends well beyond battery manufacturing, with technologies such as **BMS, EMS, PCS, and thermal management** playing a critical role in the ecosystem.


As India's energy transition gathers pace, the biggest value creation may come not only from battery manufacturers but also from the companies enabling the broader battery storage value chain.



PHARMA PATENT

Over the next four years, blockbuster drugs generating nearly **₹13.40 lakh crore** in annual sales are expected to lose patent protection, creating a significant opportunity for India's pharmaceutical industry, particularly in biosimilars and complex drug manufacturing.

The opportunity extends beyond drug makers to **CRDMOs, CDMOs, API manufacturers, formulation companies, and specialised packaging providers**, where strong capabilities, regulatory expertise, and execution are likely to drive long-term growth.



જુલાઈ મહિનો ભારતની અર્થવ્યવસ્થા માટે સતત પ્રગતિનો વધુ એક મહત્વપૂર્ણ મહિનો રહ્યો. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને કેપિટલ માર્કેટ્સમાં મજબૂત ગતિને કારણે વિકાસને નવી દિશા મળી. વિવિધ ક્ષેત્રોમાં મૂડી ખર્ચમાં વધારો, Artificial Intelligence(AI) માં વધતું રોકાણ અને સક્રિય IPO બજારે ભારતના લાંબા ગાળાના વિકાસની સંભાવનાઓને વધુ મજબૂત બનાવી. પરિણામે વ્યવસાયો અને રોકાણકારો માટે નવી તકો ઊભી થઈ અને સમગ્ર રોકાણ પરિસ્થિતિ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો.

moneycontrol

સ્ટેપટ્રેડ કેપિટલએ **ચાણક્ય ઓપર્યુનિટીઝ ફંડ-II** ના પ્રથમ કલોઝમાં **₹100 કરોડનું** સફળ સંકલન કર્યું, જે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.

આ ફંડ ઉચ્ચ સંભાવનાવાળા પ્રી-IPO બિઝનેસમાં રોકાણ કરશે, જે ભવિષ્ય કેન્દ્રિત ક્ષેત્રોમાં કાર્યરત છે અને કંપનીની લાંબા ગાળાના રોકાણકાર મૂલ્ય સર્જન પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

Outlook MONEY

કેશા ગુપ્તા, ડાયરેક્ટર અને ફંડ મેનેજર, એ આઉટલૂક મનીમાં લોક-ઇન પીરિયડ્સમાં **Alternative Investment Funds (AIFs)** વિશે લેખમાં મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે.

AIFs ને ઘણીવાર ગેરસમજવામાં આવે છે અને તેમને માત્ર "સ્ટ્રેટેજિક ફીચર" તરીકે જોવામાં આવે છે.

તેમણે ફંડ મેનેજર્સને લાંબા ગાળાની રોકાણ રણનીતિઓ અમલમાં મૂકવામાં, ટકાઉ મૂલ્ય સર્જનને સમર્થન આપવામાં અને લાંબા ગાળાની સંપત્તિ સર્જન માટે રોકાણકારોની અપેક્ષાઓ સાથે સંકલન કરવામાં મદદરૂપ થતી વ્યૂહરચનાઓ અંગે વિચાર રજૂ કર્યો છે.



KhabarPatri

Gujarati's own news web portal

અંકુશ જૈન, CFA, ડાયરેક્ટર અને ફંડ મેનેજરએ **ગુજરાતના વાયર-ફ્રી સિટી મિશન** વિશેના લેખમાં જણાવ્યું કે કેવી રીતે આ પહેલ અન્ડરગ્રાઉન્ડ વિજળી નેટવર્ક દ્વારા શહેરની પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આધુનિકતા લાવશે.

મજબૂત સરકારી રોકાણના આધારે આ પહેલ ગ્રીડની વિશ્વસનીયતા વધારશે, શહેરી સુરક્ષા મજબૂત બનાવશે અને પાવર ટ્રાન્સમિશન, ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ સેવાઓ જેવા ક્ષેત્રોમાં લાંબા ગાળાની તકો ઊભી કરશે, જે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વિકાસને ટેકો આપશે.



bt Business Today

અક્ષય દાવરા, ફંડ મેનેજર, **ચાણક્ય ઓપર્યુનિટીઝ ફંડ-II** વિશે બિઝનેસ ટુડેની વિશેષ મુલાકાતમાં પોતાની રાય શેર કરી.

તેમણે ભારતમાં મજબૂત IPO પાઇપલાઇન અને વિકસતા SME માર્કેટ અંગે પોતાના વિચારો રજૂ કર્યા.

તેમણે જણાવ્યું કે મજબૂત પ્રાથમિક બજાર પ્રવૃત્તિ આકર્ષક તકો ઊભી કરે છે, અને રોકાણકારોએ બિઝનેસની ગુણવત્તા, ગવર્નન્સ, આવકની સ્પષ્ટતા અને મૂલ્યાંકનમાં શિસ્તબદ્ધ અભિગમ રાખવો જોઈએ જેથી તેઓ માત્ર IPOમાં ભાગ લેવાને બદલે લાંબા ગાળાની સંપત્તિ સર્જન પર કેન્દ્રિત રહી શકે.



બેટરી એનર્જી સ્ટોરેજ



ભારતમાં બેટરી એનર્જી સ્ટોરેજની માંગ આગામી દાયકામાં **1 GWh થી 888 GWh** સુધી વધવાની સંભાવના છે.

આ તક માત્ર બેટરી મેન્યુફેક્ચરિંગ સુધી મર્યાદિત નથી; **BMS, EMS, PCS અને થર્મલ મેનેજમેન્ટ** જેવી ટેકનોલોજીઓ માટે પણ આ ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

જેમ જેમ ભારતનું એનર્જી પરિવર્તન વધુ ગતિ પકડશે, તેમ બેટરી નિર્માતાઓ ઉપરાંત અન્ય કંપનીઓને પણ અવસર મળશે, જે વ્યાપક બેટરી સ્ટોરેજ મૂલ્ય શ્રેણીને સમર્થન આપશે.

ફાર્મા પેટન્ટ



આગામી ચાર વર્ષમાં બ્લોકબસ્ટર દવાઓ, જેનું વાર્ષિક વેચાણ લગભગ **₹13.40 લાખ કરોડ** છે, તેમની પેટન્ટ સુરક્ષા સમાપ્ત થવાની સંભાવના છે, જે ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માટે મોટી તક ઊભી કરશે, ખાસ કરીને બાયોસિમિલર્સ અને જટિલ દવા નિર્માણ ક્ષેત્રમાં.

આ તક માત્ર દવા ઉત્પાદકો સુધી મર્યાદિત નથી; **CDMOs, API ઉત્પાદકો, ફોર્મ્યુલેશન કંપનીઓ** અને **વિશેષ પેકેજિંગ પ્રદાતાઓ** માટે પણ છે, જેઓ નિયમનકારી ક્ષમતા ધરાવે છે અને મજબૂત અમલીકરણ કરી શકે છે, જેથી લાંબા ગાળાના વિકાસને આગળ ધપાવી શકે.